

**:: તારીખ તથા સરનામું ::**

1.	કામગીરીનો પ્રકાર :	૪+૧ બેઠક વ્યવસ્થાવાળા ટેક્ષી પાસીંગવાળું માસિક ધોરણે લઘુતમ ૩૦૦૦કી.મી.ના ભાડેથી આપવા.
2.	વાહનની સ્થળ મુજબની જરૂરિયાતની વિગત :	એક ગાડી માધાપર (કચ્છ) ખાતે
3.	કોટેશનની શરતો મેળવવાનું સરનામું :	માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ, ૩જો અને ૪થો માળ, સાકાર બિલ્ડીંગ, રાજકુમાર કોલેજની સામે, ડો.રાધાકૃષ્ણન રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ (ગુજરાત). તેમજ કંપનીની વેબસાઈટ <a href="https://www.maahimilk.com">https://www.maahimilk.com</a> પરથી મેળવી શકાશે.
4.	કોટેશનની ભરીને મોકલવાનું સરનામું :	માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ, ૩જો અને ૪થો માળ, સાકાર બિલ્ડીંગ, રાજકુમાર કોલેજની સામે, ડો.રાધાકૃષ્ણન રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ (ગુજરાત).
5.	કોટેશન સાથે જોડવાના જરૂરી દસ્તાવેજો	<ol style="list-style-type: none"> <li>૧. વાહનની આર.સી બુક, વીમો, પી.યુ.સી, ફ્રાયવીંગ લાયસન્સ, ફિટનેસ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ કોટેશન સાથે જોડવી ફરજીયાત છે.</li> <li>૨. કંપનીની શરતોની લેખિત સ્વીકૃતિ સાથે જોડવી ફરજીયાત છે.</li> <li>૩. વાહનની આર.સી. બુક જે-તે કોન્ટ્રાક્ટર કે પેઢીના નામની હોવી જરૂરી છે.</li> <li>૪. અનુભવ ના પ્રમાણપત્ર</li> <li>૫. ઈ.એમ.ડી. પેટે રૂ.૧૦,૦૦૦/- નો ડીડી અથવા એક કોટેશન સાથે જમા કરાવવાના રહેશે. ડી.ડી./એક <u>Maahi Milk Producer Company Limited</u> ના નામનો – રાજકોટ ખાતે પેચેબલ.</li> </ol>

કોટેશન મંજૂર /નામંજૂર કરવાના તમામ હક્ક, સત્તા માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડના મુખ્ય કાર્યપાલકશ્રીના રહેશે તેમજ આ પ્રક્રિયાના તમામ હક્ક અભાધિત રાખેલ છે. કંપની પોતાની જરૂરિયાત મુજબ કોટેશન કોઈપણ જાતના કારણ બતાવ્યા વગર રદ કરી શકશે. ન્યાય અધિકાર ક્ષેત્ર રાજકોટ રહેશે.

## ટેક્સીવાહન ભાડે આપવાની શરતો

1. કોન્ટ્રાક્ટનો સમયગાળો ૩ વર્ષનો રહેશે, જેમાં પ્રથમ એક વર્ષ અજમાયશી રહેશે.
2. માસિક ધોરણે ભાડે આપવા માટેના વાહનનું મોડેલ ૨૦૨૧ કે તે પછીનું હોય તે ઇચ્છનીય છે, પરંતુ વાહનની કંડીશન મુજબ કમિટીની મંજુરીથી તેમાં છુટછાટ આપી શકાશે.
3. કોઈપણ સ્થળ માટે એક અથવા એકથી વધુ વાહન ભાડે આપવા માટે એક જ કોટેશનમાં ભાવ ભરીને મોકલવાના રહેશે.
4. વાષ્પિક પી.ઓની રકમના ૫% જેટલી રકમ કંપની પાસે રીફંડબલ સિક્યુરિટી ડીપોજીટ પેટે જમા રહેશે જેના પર કોઈ વ્યાજ મળવા પાત્ર નથી.
5. કંપનીના સત્તાધીશ અધિકારીની સૂચનાઓ મુજબ સમયસર વાહન પૂરું પાડવાનું રહેશે, તે સિવાય રોજિંદા કામકાજના કલાકો દરમિયાન વાહન કંપનીની ઓફિસ સેન્ટરબાયમાં રાખવાનું રહેશે. અને કોન્ટ્રાક્ટના તમામ વાહન 24 કલાક કોન્ટ્રાક્ટ માં બંધાયેલ રહેશે.
6. કોન્ટ્રાક્ટ હેઠળના વાહનનો ફક્ત કંપનીના કાર્ય માટે છે જેનો ઉપયોગ કોઈ અન્ય હેતુ માટે કરી શકાશે નહિ.
7. કિ.મી (ટ્રીપ દરમિયાન) બંને બાજુના ગણવામાં આવશે, શરૂઆતના કી.મી. કંપનીની ઓફિસેથી જ ગણવામાં આવશે.
8. બિલનું ચુકવણું લોગબુકના કી.મી તેમજ જી.પી.એસના કી.મી ની ચકાસણી કરાયા બાદ જ કરવામાં આવશે.
9. બિલનું ચુકવણું બિલ તથા જરૂરી દસ્તાવેજ સાથે જમા કરાવ્યા બાદ 30 દિવસમાં ચુકવવામાં આવશે.
10. માસિક ભાડા ઉપરાંત ટોલટેક્સ , પાર્કિંગ ચાર્જ, પરમીટ ચાર્જ યોગ્ય રસીદ આપેથી માસિક બિલ સાથે મળવાપાત્ર રહેશે.
11. ફરજ પર ડ્રાઇવરનો રહેવા-જમવા વિગેરનો તમામ ખર્ચ વાહન માલિક પર રહેશે તેમજ તે અંગે કોઈ પણ ખર્ચ કંપની દ્વારા ચુકવવામાં આવશે નહિ.
12. હાલના ઇંધણના ભાવ અનુસંધાને ભાવ ભરવાનો રહેશે. તેમજ ઇંધણના ભાવમાં વધારો કે ઘટાડો થશે તે કંપનીના નિયમો પ્રમાણે વાહનની પ્રતી કીલોમીટરની એવરેજ મુજબ અલગથી પ્રતી કીલોમીટર મુજબ ભાવ વધારવામાં કે ઘટાડવામાં આવશે જે માસિક ધોરણે ભાડે રાખેલ તથા છુટક ભાડા થી રાખેલ વાહનોને સમાન રીતે લાગુ પડશે.
13. માસિક ધોરણે ભાડે આપવામાં આવેલ વાહન તેમજ ડ્રાઇવર બદલાવા જોઈએ નહિ તેમજ જો કોઈ ફેરફાર કરવો પડે તો તે અંગે ૨૪ કલાક અગાઉ કંપનીની મંજુરી લેવાની રહેશે.
14. ડ્રાઇવરનો સંપર્ક કરવા માટે મોબાઇલ હોવો જરૂરી છે.
15. કોઈપણ ડ્રાઇવર/ કોન્ટ્રાક્ટર ઓફિસ સ્ટાફ જોડે ગેરવર્તન કરતા માલુમ પડશે તો તાત્કાલિક કોઈ પણ જાણ વગર કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે.
16. કંપનીમાં ડ્રાઇવર/ કોન્ટ્રાક્ટર કોઈ પ્રકારનું કેફી પીણું, પાન-માવા ,બીડી, ગુટખા, મસાલા તેમજ અન્ય હાનિકારક પદાર્થો લઈને આવશે તો દંડ પેટે રૂ. ૫૦૦/- વસુલવામાં આવશે અથવા કંપનીના નિયમ મુજબ યોગ્ય પગલા ભરવામાં આવશે.
17. વાહનની આર.સી. બુક જે-તે કોન્ટ્રાક્ટર કે પેઢીના નામની હોવી જરૂરી છે. તથા વાહન ફરજિયાતપણે ટેક્ષી પાસીંગ હોવું જોઈએ, ટેક્ષી પાસીંગ સિવાયના વાહનનું કોઈપણ ભાડું ચુકવવાપાત્ર રહેશે નહિ.
18. દરેક ગાડીમાં GPS હોવું ફરજિયાત છે.
19. ફરજ પરના ડ્રાઇવર પોતે સ્વચ્છ અને યોગ્ય ફેસમાં હોવા જોઈએ.
20. ફરજ પર હોય ત્યારે કોઈપણ સમયે ડ્રાઇવરે કોઈપણ નશાકારક વસ્તુઓનો/પદાર્થનો ઉપયોગ કરવો નહિ.
21. ડ્રાઇવર પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ/પરવાનો હોય એ ફરજિયાત છે, આ ઉપરાંત, લાગુ પડતા કાયદા મુજબ વાહનમાં સાથે રાખવાના થતા દસ્તાવેજો જેવાકે વાહનનો વીમો/ઇન્ઝ્યુરન્સ, રજીસ્ટ્રેશન બુક/કાર્ડ, પી.યુ.સી અને ફિનેશ સ્ટીફિકેટ વગેરે જેવા કાગળો હંમેશા વાહનમાં રાખવા ફરજિયાત છે.
22. ડ્રાઇવરે પોતાનું વાહન હંમેશા ફિટ અને કલીન રાખવું અને તે માટે સમયસર યોગ્ય ચકાસણી કરતું રહેવું, સાથે સાથે હંમેશા વાહન દરેક રીતે સ્વચ્છ રાખવાની જવાબદારી ડ્રાઇવર/કોન્ટ્રાક્ટરની રહેશે.
23. કંપનીના એડમીન વિભાગના અધિકારી દ્વારા વાહનની નિયમિત ચકાસણી/નિરીક્ષણ કરવામાં આવશે. જેમાં યોગ્ય સહકાર આપવાનો રહેશે તેમજ આ નિરીક્ષણ દ્વારા ધ્યાન પર આવેલી ક્ષતિઓ નિવારવા તાત્કાલિક પગલાંઓ ભરવાના રહેશે.
24. દરેક સમયે વાહનમાં પૂરતા પ્રમાણમાં ઇંધણ ઉપલબ્ધ હોય તે ફરજિયાત છે. જેની સંપૂર્ણ જવાબદારી ડ્રાઇવર/કોન્ટ્રાક્ટરની રહેશે.
25. વાહન અક્ષમાતના કિસ્સામાં ડ્રાઇવરે અથવા કોન્ટ્રાક્ટરે કંપનીના મેનેજમેન્ટને સૂચિત કરવા ઉપરાંત સ્થાનિક પોલીસ/ અન્ય એજન્સીઓને સૂચિત કરવાની તેમજ જે-તે લાગુ પડતા કાયદા મુજબ જરૂરી લેખિત રીપોર્ટ ફાઈલ કરવાનો રહેશે.

26. દરમયાન ડ્રાઇવરે ટ્રાફિક અને પાર્કિંગના તમામ નિયમો, કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવું ફરજીયાત છે. આવા નિયમોના ઉલ્લંઘન થવાના કિસ્સામાં તમામ જવાબદારી ડ્રાઇવર/કોન્ટ્રાક્ટરની રહેશે. આવા નિયમો અને કાયદાના ભંગ બદલ કંપની દ્વારા ચોગ્ય પગલાં ભરવામાં આવશે.
27. ટ્રાફિક તેમજ પાર્કિંગ નિયમો/કાયદાઓના ઉલ્લંઘનના કિસ્સામાં તમામ પ્રકારના દંડની રકમો ભરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.
28. ડ્રાઇવર કોઈપણ સંજોગોમાં વાહનનો અંગાત ઉપયોગ કરી શકશે નહિ અને જો કરશે તો તે માટે કંપનીની કોઈ જ જવાબદારી રહેશે નહિ.
29. ડ્રાઇવિંગ દરમયાન સંગીત, મોબાઇલ વગેરે જેવી કોઈપણ વસ્તુનો ઉપયોગ કરવો નહિ. તેમજ જો ડ્રાઇવર વિનુક આ અંગે કોઈ ફરજિયાદ મળશે તો દરેક ફરજિયાદ માટે રૂ. ૫૦૦/- કોન્ટ્રાક્ટરના બિલમાંથી કપાત કરવામાં આવશે.
30. ડ્રાઇવરોએ વાહનને રસ્તા, ટ્રાફિક અને હવામાનની પરિસ્થિતિઓ મુજબ ચોગ્ય ગતિમર્યાદામાં જ વાહન ચલાવવાનું રહેશે.
31. નિયત નમૂનામાં લોગબુક/ડ્યૂટી-સ્લીપમાં, વાહનનો ઉપયોગ શરૂ કરતા સમયે જ ફરજીયાતપણે જે-તે વપરાશકર્તા અધિકારી/કર્મચારી પાસેથી શરૂઆતના કી.મી.ના રીડિંગની તેમજ તારીખ, સમય, વાહન વપરાશનો ઉદેશ્ય, વગેરેની નોંધ કરાવવી એ ડ્રાઇવર/કોન્ટ્રાક્ટરની જવાબદારી છે. તેમજ મુસાફરી પુરી થતા અંતના કી.મી ના રીડિંગની નોંધ, કુલ કી.મી, સમય, સ્થળ વિગેરે તમામ વિગતો તુરંત જ જે-તે વપરાશકર્તા અધિકારી/કર્મચારી પાસેથી લોગબુક/ડ્યૂટી-સ્લીપમાં નોંધાવવા એ પણ ડ્રાઇવર/કોન્ટ્રાક્ટરની જવાબદારી છે.
32. ડ્રાઇવર/કોન્ટ્રાક્ટર દર માસે કંપનીના અધિકૃત કર્મચારીના સહી તેમજ સ્ટેપ્પ સાથે માસિક લોગબુક/લોગબુકની નકલ નિયમિતપણે કંપનીમાં જમા કરવાની રહેશે.
33. કંપની દ્વારા કર્મચારીઓને ઓફિશિયલ કામગીરી માટે જ વાહન પૂરું પાડવામાં આવેલ છે. જેથી કોઈ પણ કર્મચારી/વ્યક્તિ કંપનીના વાહનનો અંગાત ઉપયોગ ન કરે તે અંગે ડ્રાઇવર/કોન્ટ્રાક્ટર જાગૃત રહેશે, તેમજ જો આવા પ્રકારનો કોઈપણ બનાવ બને તો તુરંત જ કંપનીના એડમીન વિભાગને જાણ કરશે.
34. કોઈપણ સંજોગોમાં કોન્ટ્રાક્ટર અથવા તેમના ડ્રાઇવર દ્વારા અન્ય કોઈપણ વ્યક્તિને તેમજ કંપનીના કોઈપણ કર્મચારીઓને વાહન હંકારવા તેમજ વાહનનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહિ અને આ શરત ભંગાના કિસ્સામાં થનાર કોઈપણ જાતના નુકસાનની કોઈપણ જાતની જવાબદારી માહી મિલક પોડયૂસર કંપનીની રહેશે નહીં તેમજ આવા દરેક બનાવ માટે પ્રતિ બનાવ રૂ. ૧૦૦૦/- દંડકૃપે કોન્ટ્રાક્ટર પાસેથી વસુલવામાં આવશે જેની ગંભીર નોંધ લેવી.
35. વાહનને હંમેશા ફિટ અને તૈયાર રાખવાની સંપૂર્ણ જવાબદારી જે-તે ડ્રાઇવર/કોન્ટ્રાક્ટરની છે. મુસાફરી દરમયાન વાહનની નબળી કે ખરાબ હાલત/સ્થિતિ થકી વાહન બ્રેક-ડાઉન થવાના કિસ્સામાં અથવા ડ્રાઇવરની ગેરવતથંક તેમજ અધિકારીની સુચનાઓના અનાદર કરવાના કિસ્સામાં જે-તે અધિકારી તાત્કાલિક ધોરણે જે-તે દિવસ માટે વાહન છોડી તેમની રીતે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી પોતાનું ઓફિશિયલ કામ પૂર્ણ કરશે. આવા કિસ્સામાં કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થાનો તમામ ખર્ચ જે-તે કોન્ટ્રાક્ટર પાસેથી વસુલવામાં આવશે.
36. કોઈપણ સંજોગોમાં વાહન ભાડે આપવા માટેનો કરાર અન્યને તબદીલ કરી શકશે નહીં અથવા પેટા કરારથી અન્યને આપી શકશે નહીં.
37. કોઈપણ તકરારના કિસ્સામાં ન્યાયક્ષેત્ર રાજકોટ રહેશે.
38. કંપનીની જરૂરિયાત મુજબ ભાડે આપવામાં આવતી છુટક ગાડી સંપૂર્ણ રીતે કોન્ટ્રાક્ટરની માલીકી ના હોવા જોઈએ અને વાહન અને ડ્રાઇવર પર કોન્ટ્રાક્ટરનું સંપૂર્ણ નીયંત્રણ હોવું જોઈએ.

**વાહન ભાડે આપવા માટેનું અરજી પત્રક**

**(જો પેઢીના નામે કોટેશન ભરતા હોય તો લેટર ફેડ પર પ્રિન્ટ કરવું)**

તારીખ:-

પ્રતિ શ્રી ,

માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ,  
૩જો અને ૪થો માળ, સાકાર બિલ્ડીંગ,  
રાજકુમાર કોલેજ સામે, ડૉ. રાધાકિશન રોડ,  
રાજકોટ.

સવિનય સહ જણાવવાનું કે માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ, રાજકોટ દ્વારા નક્કી કરેલ બેઠક વ્યવસ્થાવાળા એ.સી. પેસેન્જર વાહન માટે કંપનીના ધારાધોરણો અને જરૂરિયાત મુજબ વાહન ભાડે આપવા તેમજ સર્વિસ આપવા સક્ષમ છુ/ધીએ અને માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ, રાજકોટની કોન્ટ્રાક્ટરની શરતોને આધિન રહીને આ સાથે જોડેલ ભાવપત્રક મુજબ હું/અમે મારું/અમારું વાહન ચલાવવા કોટેશન ભરું/ભરીએ/છીએ.

1. પેઢી/અરજદારનું નામ :- \_\_\_\_\_
2. સરનામું અને પીન કોડ :- \_\_\_\_\_
3. મોબાઇલ નંબર :- \_\_\_\_\_
4. હાલનો વ્યવસાય :- \_\_\_\_\_
5. વાહનનો પ્રકાર-કંપની :- \_\_\_\_\_
6. વાહનનું મોડેલ :- \_\_\_\_\_
7. આધાર કાર્ડ નંબર (ઝેરોક્ષ કોપી લગાવવી) : \_\_\_\_\_
8. જી.એસ.ટી નંબર (કોપી લગાવવી) :- \_\_\_\_\_
9. પાનકાર્ડ નંબર (ઝેરોક્ષ કોપી લગાવવી) :- \_\_\_\_\_
10. વાહનનો રજીસ્ટર નંબર :- \_\_\_\_\_
11. અગાઉ ક્યારેય માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ સાથે વાહન કોન્ટ્રાક્ટર કે અન્ય કોઈ પણ રીતે કામ કરેલું છે? હા/ના જો હા હોય તો તેની વિગત લખવી. \_\_\_\_\_  
જો ના હોય તો માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ કે અન્ય કંપનીના રેફરન્સ આપનાર અધિકારીનું નામ અને કોન્ટેક નંબર જણાવવો. \_\_\_\_\_
12. શું આપ કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવો છો? જો હા તો વિગત લખવી. \_\_\_\_\_
13. માસિક ધોરણે વાહન ભાડે આપવા માટે કોટેશન સાથે ઈ.એમ.ડી. પેટે રૂ.૧૦,૦૦૦/- નો ડીડી જમા કરાવવાના રહેશે. ડી.ડી. Maahi Milk Producer Company Limited ના નામનો – રાજકોટ પેઓબલનો આપવાનો રહેશે.

આશી હું ખાતરી પૂર્વક જહેર કરું છુ કે માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડમાં વાહન ભાડે આપવા અંગે જણાવેલ તમામ શરતો વાંચેલ છે અને તે મને બંધનકર્તા રહેશે. આ કંપની કે અન્ય સરકારી/અર્ધ સરકારી/સરકાર હસ્તકની સંસ્થાઓ દ્વારા ક્યારેય પણ મને ગેરલાયક ઠરાવેલ નથી કે મારી ગેરલાયકાતનો સમય ચાલુ નથી. ઉપર જણાવેલ વિગતો મારી જાણ મુજબ સાચી છે અને જો તેમાં કોઈપણ વિગત ખોટી હશે તો તે અંગે માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ, રાજકોટનો નિર્ણય અંતીમ રહેશે અને તે મને બંધનકર્તા છે.

આપનો વિશ્વાસુ,

અરજદાર/પેઢીનું નામ \_\_\_\_\_ અરજદાર///પેઢીનું સહી અને સિક્કો \_\_\_\_\_

નોંધ :- પ્રતિ માસ ડી.મી. ના તેમજ માસિક ડી.મી. બાદના એક્સ્ટ્રા ડી.મી.ના ભાવ ભાવપત્રકમાં જુદા દર્શાવવા.

માસિક ધોરણે ગાડી ભાડે આપવા માટેનું પત્રક :

અ નુ. ક.	સ્થળ	વાહનનો પ્રકાર	માસિક 3000 કી.મી નું ભાડું	3000કી.મી બાદના એક્સ્ટ્રા કી.મી.ના ભાવ
1.	રાજકોટ	હોન્ડા અમેર, મારુતિ સ્વીફ્ટ ડિઝાયર વગેરે (૪+૧સીટ)		

હાલના ઇંધણ (પેટ્રોલ/ડીઝલ/સીએનજી) ના ભાવને ધ્યાને રાખી ભાવ ભરવાનો રહેશે. તેમજ ઇંધણ (પેટ્રોલ/ડીઝલ/સીએનજી) ના ભાવમાં વધારો કે ઘટાડો થશે તે કંપનીના નિયમો પ્રમાણે વાહનની પ્રતી કીલોમીટરની એવરેજ મુજબ અલગથી પ્રતી કીલોમીટર મુજબ ભાવ વધારવામાં કે ઘટાડવામાં આવશે, જે આખરી રહેશે.

કોટેશન ભરનારના સહી સિક્કા

તા. ૦૫/૦૨/૨૦૨૩ ના રોજ ઇંધણ(પેટ્રોલ/ડીઝલ) ની કિંમતને ધ્યાને રાખી ગણતરી કરી અરજી પત્રકમાં ભાવ લખવો ત્યાર બાદ કંપની ના નિયમ મુજબ ઇંધણ(પેટ્રોલ/ડીઝલ)ની કિંમતમા આવતા વધારા કે ઘટાડા મુજબ ભાવ આપવામાં આવશે જે આખરી રહેશે. તા.૦૫/૦૨/૨૦૨૩ના રોજ પ્રતી લીટર ડિઝલ ભાવ. રૂ ૮૧.૮૫/-, પેટ્રોલ ભાવ. રૂ ૯૬.૧૯/-.

\* GST ટેક્સના સંદર્ભમાં જે સ્લેબ લાગુ પડતો હોય તેની સામે ફરજીયાત (✓) નિશાન કરવું.

જો પેઢી/અરજદાર કોપોરેટ બોડી હોય તો
૧૨% ફોરવર્ડ GST સ્લેબ
૦૫% ફોરવર્ડ GST સ્લેબ
GST લાગુ પડતું નથી

જો પેઢી/અરજદાર કોપોરેટ બોડી ન હોય તો
૧૨% ફોરવર્ડ GST સ્લેબ
૦૫% રીવર્સ GST સ્લેબ
GST લાગુ પડતું નથી

કોટેશન ભરનારના સહી સિક્કા

શરતોના ઉલ્લંઘન ના કિસ્સામાં નીચે મુજબની રકમ દંડપેટે વસૂલવામાં આવશે :

અ નુક	શરતોનું ઉલ્લંઘન	પ્રથમ બનાવ	બીજો બનાવ	ત્રીજો બનાવ	નોંધ
૧	પેસેન્જર અથવા કોઈપણ કંપનીના કર્મચારી સાથે ગેરવર્તણૂક કરવી.	૨૦૦૦	૩૦૦૦	૫૦૦૦	દરેક બનાવ માટે
૨	એ.સી.ની બિન-કાર્યક્ષમતાના કિસ્સામાં (એ.સી ન ચાલવું)	૧૦૦	૪૦૦	૪૦૦	
૩	ટ્રાફિક અને ફ્રાઇવિંગ નિયમોનું ઉલ્લંઘન કરવું.	૪૦૦	૧૦૦૦	૧૫૦૦	
૪	વાહન ક્ષતિગ્રસ્ત થવાના કિસ્સામાં એક કલાકની અંદર સમાન વાહન વ્યવસ્થા પૂરી પાડવામાં નિષ્ફળતાના કિસ્સામાં	૪૦૦	૧૦૦૦	૧૫૦૦	
૫	અગાઉથી જાણકારી આપ્યા સિવાય ફ્રાઇવર કે વાહન બદલવાના કિસ્સામાં	૪૦૦	૪૦૦	૪૦૦	
૬	કોટેશનની અન્ય કોઈપણ શરતોના ઉલ્લંઘનના કિસ્સામાં	૪૦૦	૪૦૦	૪૦૦	
૭	૧૫ મિનિટ થી વધારે મોડા આવવાના કિસ્સામાં	૨૦૦	૪૦૦	૪૦૦	

ગંભીર ગેરવર્તણૂકના કિસ્સામાં કોઈપણ નોટિસ આપ્યા વગર કરારનો અંત આણવામાં આવશે. અન્ય કિસ્સાઓમાં કરારનો અંત લાવવા અને સેવાઓ બંધ કરવા માટે ૩૦ દિવસ અગાઉ લેખિતમાં નોટિસ આપવાની રહેશે.



સીલબંધ કવર

પેસેન્જર વાહન ભાડે આપવા માટેનું કોટેશન

પ્રતિ,

માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ,  
૩જો ૪થો માળ, સાકાર બિલ્ડિંગ,  
રાજકુમાર કોલેજની સામે, ડૉ. રાધા કૃષ્ણન રોડ,  
રાજકોટ ૩૬૦૦૦૧ (ગુજરાત).



મોકલનાર:

મોકલનારનું નામ : \_\_\_\_\_

મોબાઇલ નંબર: \_\_\_\_\_

સરનામું : \_\_\_\_\_  
\_\_\_\_\_

ઈ-મેલ \_\_\_\_\_

